

તાત્કાલિક પ્રકાશન માટે

કાઉન્સિલે રાયરસનની હાજરી ઊભી કરવા ડાઉનટાઉન બ્રામ્પટનમાં સ્થળાંતર કર્યું

*બ્રામ્પટનને કેનેડાનું સાઈબર સિક્યુરિટી કેપિટલ બનાવવાના દૂરદેશીપણુંથી
શહેરમાં નવીન શોધ અને નોકરીઓ ઊભી કરવાની ઝડપ વધશે*

બ્રામ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 13, 2019) - રાયરસન યુનિવર્સિટી અને સીટી ઓફ બ્રામ્પટન વચ્ચેનો સહયોગ રોમાંચક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આજે, બ્રામ્પટન કમિટી ઓફ કાઉન્સિલે રાયરસન યુનિવર્સિટીની આગેવાનીમાં ડાઉનટાઉન બ્રામ્પટનમાં ઈનોવેશન હબ (નવીન શોધ કેન્દ્ર) અને સાઈબર-સિક્યુરિટી કેટાલિસ્ટ સ્થાપવા માટે અનિવાર્ય ભંડોળ અને જરૂરી સંસાધનોની રૂપરેખા બનાવવા રાયરસન યુનિવર્સિટી સાથે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કરવા કર્મચારીગણને નિર્દેશ આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. આ પ્રસ્તાવ મંજૂરી માટે આગામી અઠવાડિયે કાઉન્સિલ પાસે જશે.

નાણાકીય પ્રભાવો (ફાઈનાન્સિયલ ઈમ્પલિકેશન્સ) અને સાઈબર સિક્યુરિટી કેટાલિસ્ટનું ભંડોળ અને પાઈલોટ ઈન્ક્યુબેશન/ઈનોવેશન હબને આ શહેરના 2019 અંદાજપત્ર મનસૂબાના (બજેટ ડેલિવેરેશન્સના) ભાગ તરીકે પણ ગણવામાં આવશે, જે માર્ચ 18 નાં રોજ શરૂ થાય છે.

આ પ્રસ્તાવ બ્રામ્પટનને કેનેડાનું સાઈબર સિક્યુરિટી કેપિટલ બનાવવા માટે શાળાના દૂરદેશીપણું પર, ગ્લેન કેની, ડેપ્યુટી પ્રોવોસ્ટ (યુનિવર્સિટીના ઉચ્ચ પદાધિકારી વહીવટકાર) અને વાઈસ-પ્રોવોસ્ટ, યુનિવર્સિટી પ્લાનિંગ, રાયરસન યુનિવર્સિટીની રજૂઆતને અનુસરે છે. આ દૂરદેશીપણુંમાં સામેલ છે:

- **ચાન્ગ સ્કૂલની સેવાઓ વધારવી:** આ વર્ષની શરૂઆતમાં, ચાન્ગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઈંગ એજ્યુકેશને બે સાઈબર સિક્યુરિટી અભ્યાસક્રમો શરૂ કર્યા, બંને બ્રામ્પટન સીટી હોલ વેસ્ટ ટાવરમાં યોજાયા હતા. પૂર્ણ પ્રમાણપત્ર કાર્યક્રમો શરૂ કરવાના આયોજનો ચાલી રહ્યા છે.
- **બ્રામ્પટન ઈનોવેશન હબનો શુભારંભ:** બ્રામ્પટન ઈન્ક્યુબેશન/ઈનોવેશન હબ વેસ્ટ ટાવરમાં પણ સ્થિત થશે અને આ સ્થળે નવીનીકરણ કામો પૂરા થવાની નજીકમાં છે. 'DMZ' નું સંચાલન કરનાર, રાયરસન યુનિવર્સિટી, શરૂઆતના તબક્કે ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે દુનિયાની આગેવાન યુનિવર્સિટીની દોરવાણી કરતું ઈન્ક્યુબેટર, નવીન શોધ અને સ્ટાર્ટ-અપ વિસ્તારોમાં એક સ્થાપિત અગ્રેસર છે.
- **સાઈબર સિક્યુરિટી કેટાલિસ્ટનો શુભારંભ:** સાઈબર સિક્યુરિટી કેટાલિસ્ટ, સાઈબર સુરક્ષામાં નવીન શોધ અને સહયોગ માટે એક નવું રાષ્ટ્રીય કેન્દ્ર બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાઈબર ક્રાઈમ વૈશ્વિક સ્તરે કંપનીઓ માટે નુકસાનમાં \$6 ટ્રિલિયનનો ખર્ચ ઊભો કરશે અને આ વર્ષના અંતે લગભગ 1.5 મિલિયન જેટલી નોકરીઓ ખાલી રહેશે આ બાબતોને ધ્યાનમાં લેતા, આ કેન્દ્ર વ્યવસાયિક તાલીમ, સંશોધન અને વિકાસ, વાણિજ્યિક સંપ્રાપ્તિ અને સાર્વજનિક શિક્ષણ પૂરું પાડીને સાઈબર સુરક્ષા માટેનું કેન્દ્ર બનશે.

અવતરણો (ક્વોટ્સ):

“આ બ્રામ્પટનને આગળ વધારવા માટે બહુ રોમાંચક પગલું છે, જે રાયરસન યુનિવર્સિટી સાથે મહત્વના પ્રોજેક્ટ્સને હકીકતની નજીકમાં લાવશે. આ પ્રોજેક્ટ્સ આર્થિક વિકાસને વેગ આપવામાં, નોકરીઓ ઊભી કરવામાં, અને બ્રામ્પટનને સાઈબર સુરક્ષા માટેના કેન્દ્ર તરીકેની સ્થિતિ

“આપાવવામાં મદદરૂપ થશે. આપણાં માધ્યમિક-પર્યંત વિદ્યાર્થીઓ પાસે હવે એ ક્ષેત્રમાં પ્રવેશવાના વિકલ્પો રહેશે જે વૈશ્વિક સ્તરે સંબંધિત હોય, અને આપણી સ્થિતિને એક મહત્વના, વિશ્વ સ્તરીય શહેર તરીકે લાગુ કરે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

“સીટી ઓફ બ્રામ્પટન અને શેરિડેન કોલેજમાં પોતાના ભાગીદારોને, શિક્ષણ પસંદગીઓ વિસ્તારવામાં મદદ કરવા અને બ્રામ્પટનમાં નવીન શોધ અને ઉદ્યમવૃત્તિમાં તકો સુધી પહોંચી વિસ્તારવામાં મદદ કરવા રાયરસન કટિબદ્ધ છે. આ બંને શહેર માટે આર્થિક ચાલક પરિભળો બની રહેશે અને અમે અમારી સહાયતા, આગેવાની અને નિપુણતા પૂરી પાડવામાં અને બ્રામ્પટનમાં આ તકો લાવવામાં રાજી છીએ.”

- ગ્લેન ક્રેની, ડેપ્યુટી પ્રોવોસ્ટ (યુનિવર્સિટીના ઉચ્ચ પદાધિકારી વહીવટકાર) અને વાઈસ-પ્રોવોસ્ટ, યુનિવર્સિટી પ્લાનિંગ, રાયરસન યુનિવર્સિટી (Glenn Craney, Deputy Provost and Vice-Provost, University Planning, Ryerson University)

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca